



we build tomorrow's world

PUROHIT CONSTRUCTION LIMITED

CIN : L45200GJ1991PLC015878



August 15, 2023

Dy General Manager
BSE Limited
Corporate Relationship Dept
1st Floor, New Trading Ring,
Rotunda Bldg
PJ Towers, Dalal Street, Fort
Mumbai-400 001

Scrip Code:538993

Sub: Publication of Standalone Unaudited Financial Results of the Quarter ended on 30th June, 2023.

Dear Sir,

In pursuance with the Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 We inform you that a Meeting of Board of Directors of Purohit Construction Limited held on 14th August, 2023 at the registered office of the company at Ahmedabad has approved the Standalone Unaudited financial results for the Quarter ended on 30th June, 2023.

The Unaudited results have been sent to you on conclusion of the said meeting.

We are pleased to enclose herewith the copy of newspaper in which the said unaudited results have been published.

Free Press Gujarat (English) 15th August, 2023

Lok Mitra (Gujarati) 15th August, 2023

Please find the same in order and acknowledge the receipt of the above.

Thanking You

Yours Faithfully

Purohit Construction Limited

Nishit Sandhani
Company Secretary

Encl.: As stated above.



Aadhaar fingerprints used to siphon off bank money in Gujarat's Dahod



VADODARA: Think twice before using fingerprint impressions for any financial transaction. You may end up losing your bank savings. Police have busted a cyber fraud involving several persons used fingerprint impressions to withdraw money from victims' bank accounts.

The duo managed to gather fingerprints of nearly 1,000 persons in Dahod and used a few to siphon money from their accounts. "Not many know they can withdraw money from their bank account using their fingerprints and identity card without OTP authentication. The duo took advantage of the Aadhaar Enabled Payment System to defraud some people and withdrew money from their bank accounts," said B N Patel, police inspector, cybercrime.

The accused, Sanjiv Baria, a B.Tech student and Satish Bhabhor, both residents of Dahod, were arrested by the cybercrime sleuths. Bhabhor runs a fair-price shop in Garbada taluka of Dahod and had thousands of fingerprints of locals who used them to get their monthly grocery supply. "Bhabhor knew that money could be withdrawn from the bank account using AEPs. So, he took the help of Baria who is studying B-Tech in Gandhinagar. Baria came up with a trick to clone fingerprint impressions of the victims and use them to withdraw money from their bank accounts," Patel told TOI.

He kept the phone screen with the image of the victims' thumb impression on the scanner and entered the Aadhaar details of the victims to transfer the money from their bank accounts to an account that he had opened. Interestingly, the bank account he opened to siphon off the money was created by using the fingerprints and Aadhaar details of one of the victims.

Once the money was transferred into his newly created account, he used to withdraw it. The scam came to light when a victim learned that nearly Rs 1 lakh was siphoned off from his bank account following which he approached the police.

1,561 LLB seats vacant at private law colleges

Ahmedabad: Sources in Gujarat University on Tuesday said that 1,561 Bachelor of Law (LLB) seats in private law colleges are vacant as students who were allotted the seats have not confirmed their admissions. Sources said that the students had registered for admission to private colleges after the government cut down the number of seats in GU affiliated grant-in-aid colleges. However, only 440 students confirmed their admissions while 1,561 students did not, leaving the seats vacant. The university will announce another round of admissions to fill up these seats. According to GU data, there are a few seats available now in 21 private and grant-in-aid colleges as the university has reduced the number of seats from 3,540 to 2,067. tnn

Waste paper trader cheated of over Rs 1 crore, 10 booked

SURAT: A 45-year-old businessman filed a complaint of cheating with the Pal police station in the city. In his plaint, Vishal Khatiwala told the police that officials of Mumbai-based Parle Software Ltd bought paper waste from him on couple of occasions but did not pay Rs 1.28 crore for the products, following which he filed a complaint. According to case details, Khatiwala has been operating Ganesh Waste Collection LLP in Pal area since 2017. In June 2018, Vishal Khatiwala, CEO of Parle Software Ltd came to meet Khatiwala and told that their company buys paper waste.

Khatiwala was also informed that their company is based in Mumbai and have a branch in Surat's Udhna road. Three days later, Mahrajwala took other officials of the company with him to meet Khatiwala. After this meeting, Khatiwala first sent them waste worth Rs 5.49 lakh, for which payment was done in 10 days as against 30 to 45 days term. This won Khatiwala's trust and he kept sending goods to waste company's Mumbai and Surat branches. During June 2018 to July 2019, Khatiwala sent goods worth Rs 8.94 crore to the Mumbai branch of Parle Software, of which only Rs 8.19 crore payment was done in time. On the other hand, he sent Rs 1.07 crore goods to the Udhna branch of the company during 2019, of which only Rs 54 lakh payment was done. Both the branches of Parle Software Ltd together failed to make total payment of Rs 1.28 crore to

HC pulls up DSP over driver's death

Ahmedabad: The Gujarat high court on Friday came down heavily on IAS officer Ravi Teja, who is currently the Gandhinagar district superintendent of police (SP), and a police inspector (PI) posted in Junagadh district, for not registering an FIR over the death of a police van driver in Junagadh and his body was found hanging from a tree. Police registered a case of accidental death. His son, Ritesh, demanded an investigation, alleging murder, because Lavanika's body had antemortem injuries. When Junagadh police did not investigate the case, Ritesh moved HC. Justice Samir Dave summoned the then Junagadh SP Ravi Teja and police inspector MM Vadhwa and castigated them for not heeding the allegations regarding Lavanika's death.

WESTERN RAILWAY - RAJKOT DIVISION			
VARIOUS ENGINEERING WORKS			
Sr. No.	e-Tender No.	Name of work	Approximate NIT Cost
01	DRM-RJT-23-E-45	Rajkot Division- Provision of RUB/Sw/way by providing RCC Box (1 X 5.50 M X 5.0 M) and U-Wall / Approach Road at LC No.190 at KM 821/1-2 bet Hapa-JAM and providing RCC Box (1 X 6.0 M X 5.0 M) and U-Wall / Approach Road at LC No.184 at KM 794/6-7, Lakhabawal-Pipli section. Date & Time of Opening of Tender: 31-08-2023 15:00 Hrs.	₹ 9,98,87,628.34
02	DRM-RJT-23-E-47	Rajkot Division- Provision of RUB by providing RCC Box (1 X 6.0 M X 4.5 M) and U-Wall / Approach Road at LC No. 213 C class at Km. 844/5-6 and providing RCC Box (1 X 5.50 M X 4.0 M) and U-Wall / Approach Road at LC No. 214 C class at Km. 845/0-4 between Lakhabawal-Pipli section. Date & Time of Opening of Tender: 31-08-2023 15:00 Hrs.	₹ 9,99,69,304.84
03	DRM-RJT-23-E-47	Rajkot Division- Providing RUB by providing RCC Box (1 X 5.50 M X 5.0 M) and U-Wall / Approach Road at LC No.275 at KM 940/3-4 between Bhatiyaj-Okhambadi section. Date & Time of Opening of Tender: 31-08-2023 15:00 Hrs.	₹ 5,52,69,792.20
04	DRM-RJT-23-E-48	Rajkot Division- Providing RUB by providing RCC Box (2 X 6.0 M X 5.0 M) and U-Wall / Approach Road at LC No. 238 at KM 882/6-7 between Khambhaliya-Bhatoli section. Date & Time of Opening of Tender: 31-08-2023 15:00 Hrs.	₹ 7,83,99,437.88
05	DRM-RJT-23-E-49	Rajkot Division- Providing RUB by providing RCC Box (2 X 5.50 M X 5.0 M) and U-Wall / Approach Road at LC No. 238 at KM 884/1-2 between Khambhaliya-Uttari section. Date & Time of Opening of Tender: 31-08-2023 15:00 Hrs.	₹ 8,13,07,624.65

Use us on [Facebook](https://www.facebook.com/WesternRly) [Twitter](https://www.twitter.com/WesternRly) [Instagram](https://www.instagram.com/WesternRly)

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

NOTICE INVITING APPLICATIONS
Invitation of Applications for Authorization of Yatri Ticket Suvidha Kendra (YTSK) over AHMEDABAD Division Western Railway
 Divisional Railway Manager (Commercial), Western Railway, Ahmedabad invites sealed applications in Hindi / English for and on behalf of the President of the Indian Railways who have completed 18 years of age & are/ have been authorized ticketing appointed by Railways including UTBS, STBA, Ex. STSA, Ex. RTA and agents appointed by IRCTC with the experience of a minimum 02 (Two) years for establishing & operating Computerized Passenger Reservation System (PRS) cum Unreserved Ticket System (UTS) terminals (called 'Yatri Ticket Suvidha Kendra (YTSK)') over Ahmedabad Division of Western Railway for the issue of reserved/ unreserved rail tickets through Computerized Unreserved Ticketing system. The interested applicants fulfilling the laid down conditions may be prescribed from time to time by the Railway administration may apply for an initial period of three years subject to subsequent renewals as per guidelines issued by the Railway Board from time to time. The application forms can be downloaded from the Railway's website www.indianrailways.gov.in and submitted on or before the closing date of 15-09-2023 at 15:00 hrs. The applications invited for authorization of the establishment of 'Yatri Ticket Suvidha Kendra (YTSK)' over Ahmedabad Division are to be submitted in an envelope with enclosing required documents as per eligibility criteria provided on Railway's website (www.wr.indianrailways.gov.in). The envelope is to be super scribbled with 'Application form for Yatri Ticket Suvidha Kendra (YTSK) near Office Address & Website' and the applicant with pin code. The application should reach the office of the Divisional Railway Manager (Commercial), N. Chamunda Mata Mandir, Opp. Gujarat Cancer Hospital society, Andampura, Ahmedabad-382345 on or before 15-09-2023 up to 15:00 hrs. The applications received after the above mentioned date and time will not be entertained. Any postal delay will not be taken into account.

Use us on [Facebook](https://www.facebook.com/WesternRly) [Twitter](https://www.twitter.com/WesternRly) [Instagram](https://www.instagram.com/WesternRly)

MEHTA HOUSING FINANCE LIMITED

Regd. Off: Plot No. 1A, Revenue Survey No. 203, Savarkunda Road, Taveida, Mahuva Bhavnagar, Gujarat - 364290 | M: 98989 08652
 Email: mehtahousingfinancecd@gmail.com | Website: www.mehtahousing.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2023

Sr. No.	Particulars	Quarter Ended			Year ended
		June 30 2023	Mar 31 2023	June 30 2022	
1.	Total Income from Operations	0.00	0.00	0.00	0.00
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(6.15)	(4.61)	(6.82)	(19.43)
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(6.15)	(4.61)	(6.82)	(19.43)
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(6.15)	(4.61)	(6.82)	(19.43)
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(6.15)	(4.61)	(6.82)	(19.43)
6.	Equity Share Capital	308.20	308.20	308.20	308.20
7.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) (in Rs.)				
1. Basic:		1.0 (200)	1.0 (150)	1.0 (221)	1.0 (0630)
2. Diluted:		2.0 (200)	2.0 (150)	2.0 (221)	2.0 (0630)

Notes: The above is an extract of the detailed format of Un-audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said results alongwith the Limited Review Report of the Statutory Auditors are available on BSE Limited (BSE) website (www.bseindia.com) and on the Company's website (www.mehtahousing.com). The Un-audited Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their Meeting held on August 14, 2023.

For Mehta Housing Finance Limited
 Vishal Ruparel
 Chairman & Managing Director
 DIN: 00077167

PUROHIT CONSTRUCTION LIMITED

REGD OFFICE: 401, PUROHIT HOUSE, OPP. STADIUM, NAVRANGPURA, AHMEDABAD-380 009
 Telephone Number- 079-26426486, Email Id: cs@purohitconstruction.com
 Website: www.purohitconstruction.com

Statement of Standalone unaudited Financial Results for the Quarter Ended 30th June, 2023

Sl. No.	Particulars	Three Months ended			Year ended
		30/06/2023	30/06/2022	31/03/2023	
1.	Total Income from Operations	0.00	0.00	25.00	123.03
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(6.02)	(6.02)	(6.02)	(76.06)
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(6.02)	(6.02)	(6.02)	(76.06)
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(6.02)	(6.02)	(6.02)	(76.06)
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(6.02)	(6.02)	(6.02)	(76.06)
6.	Equity Share Capital (Equity Shares of Rs. 10/- each)	402.56	402.56	402.56	402.56
7.	Reserves (including Retention Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				
8.	Earnings Per Share (Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
1. Basic:		(0.04)	(0.04)	(0.04)	(1.72)
1. Diluted:		(0.04)	(0.04)	(0.04)	(1.72)

Notes:
 1. The Above Financial Results have been reviewed by the Audit committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 14.08.2023
 2. The above result for the quarter ended on 30.06.2023 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable.
 3. The Limited Review of Unaudited Financial Results for the Quarter ended June 30, 2023 as required in terms of Clause 33 of SEBI (LODR) Regulations, 2015 has been carried out by Statutory Auditors.
 4. The Figures pertaining to previous periods have been regrouped, reclassified and restated wherever necessary.
 5. The above financial results are available on the Company's website www.purohitconstruction.com and also on the website of BSE (www.bseindia.com)

For and on behalf of the Board of Directors
 NARENDRA M. PUROHIT
 (Chairman & Managing Director)
 DIN:00755195

NARMADA MACPLAST DRIP IRRIGATION SYSTEMS LTD

Regd. Office & Works : Plot No. 119-120, Santaj-Vadisar Road, Santej, Taluka : Kalol Dist. Gandhinagar : 382721 Ph. No. 079-27498670
 Standalone Unaudited Financial Results for the Quarter ended 30th June, 2023 (Rs. In Lacs)

Particulars	Quarter ended		
	30/06/2023	31/03/2023	30/06/2022
Total Income from operations	6.32	1,030.99	499.97
Net Profit / (Loss) from ordinary activities: after tax	0.96	0.88	10.35
Total Comprehensive Income for the period (Comprising profit for the period and Other Comprehensive Income for the period) after tax	0.86	0.88	10.35
Equity Share Capital	362.30	362.30	362.30
Earnings Per Share (of Rs. 10/- each)			
Basic:	0.02	0.02	0.29
Diluted:	0.02	0.02	0.29

1. The above is an extract of the detailed quarterly results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Results is available on the stock exchange website (www.bseindia.com) and also available on the Company's website (www.NARMADADRIP.COM)

FOR NARMADA MACPLAST DRIP IRRIGATION SYSTEMS LTD
 JITEN VIRAJLAL VAGHASIA
 WHOLE - TIME DIRECTOR
 (DIN : 02433557)

GUJARAT NATURAL RESOURCES LIMITED

Regd. Office : 3rd Floor, A Wing, Gopal Palace, Opp. Ocean Park, Nr. Nehru Nagar, Satellite Road, Ahmedabad-380015
 CIN : L27100G199P139016158

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023

PARTICULARS	Quarter ended			Year ended
	30-06-2023	31-03-2023	30-06-2022	
Total Income from operations	619.97	410.33	378.86	1433.30
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	119.65	128.99	-175.77	-363.04
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	119.65	-81.41	-175.77	-573.43
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	119.65	-127.93	-175.77	-619.96
Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	119.65	-127.93	-175.77	-619.96
Equity Share Capital	8025.16	8025.16	8025.16	8025.16
Equity Share Capital (Face Value of Rs. 10/- each)	-	-	-	3279.69
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualised)				
Basic:	0.15	-0.16	-0.22	-0.77
Diluted:	0.15	-0.16	-0.22	-0.77
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) (not annualised)				
Basic:	0.15	-0.16	-0.22	-0.77
Diluted:	0.15	-0.16	-0.22	-0.77

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023

PARTICULARS	Quarter ended			Year ended
	30-06-2023	31-03-2023	30-06-2022	
Total Income from operations	61.00	65.00	61.00	71.00
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	-14.72	-1.27	-14.11	-41.87
Profit after tax	-14.72	-1.27	-14.11	-41.87

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.gnatresources.com)

For GUJARAT NATURAL RESOURCES LTD.
 Sd/-
 SHAMJI A. SHAH
 MANAGING DIRECTOR, DIN:00297447

Unison Metals Limited

CIN No: L52100G199P0C013964
 Reg Office : Plot No.5015, Ph-V, Nr: Ramol Cross Road, GIDC, Valva, Ahmedabad-382445
 Website - www.unisongroup.net, Email: unisonmetals@gmail.com - Telephone - +91-07925841512

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE, 2023

Particulars	Quarter Ended		Year Ended	Quarter ended		Year Ended
	30th June 2023	31st March 2023		30th June 2022	31st March 2022	
	Unaudited	Audited		Unaudited	Audited	
Total Income from operations (Net)	1,388.79	1,384.65	1,828.01	13,228.13	5,513.30	2,445.50
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	86.81	286.30	-250.04	97.23	25.83	475.20
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	86.81	286.30	-250.04	97.23	25.83	475.20
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	86.81	286.30	-250.04	97.23	25.83	475.20
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	86.81	286.30	-250.04	97.23	25.83	475.20
Total Comprehensive Income for the period (comprising profit / (loss) for the period after tax and other comprehensive income (after tax))	86.81	286.30	-250.04	97.23	25.83	475.20
Equity Share Capital (Face Value of Rs. 10/- each)	1600	1600	1600	1600	1600	1600
Reserves (including Retention Reserve) as per Audited Balance Sheet of the previous year						
Earnings Per Share (EPS)						
Basic EPS before and after extraordinary items for the period (not annualised) in INR 30/- Share	0.61	1.32	-1.54	0.60	1.32	2.32
Diluted EPS before and after extraordinary items for the period (not annualised) in INR 30/- Share	0.61	1.32	-1.54	0.60	1.32	2.32

1. This Statement has been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 Accounting Standards Rules, 2015 as amended from time to time.
 2. These results have been recommended for adoption by the Audit Committee in its meeting held on August 14, 2023, and approved by the Board of Directors at its meeting held on August 14, 2023.
 3. The Company publishes standalone financial results along with the consolidated financial results. In accordance with the Ind AS 108, 'Operating Segments', the Company has disclosed the segment information in the consolidated financial results and therefore no separate disclosures on segment information is given in the standalone financial results for the quarter ended 30 June, 2023.
 In line with Ind AS - 108 operating segments and basis of the review of operations being done by the Senior Management of the Parent, the operations of the group fall under 2 segments: (a) Stainless Steel (b) Ceramic (c) Sulfur Silicate
 4. Note on Inventory lying at third party and amount receivable thereof: The Company has outstanding receivables from Naapitol amounting to INR 113.12 Lacs. In addition, inventory of Unisolv lying at their warehouse amounts to INR 102.85 Lacs. Naapitol has appointed arbitrator to resolve the dispute between the Company and Naapitol. Against this the Company has approached the Hon'ble High Court at Mumbai, to rescind the appointment of arbitrator appointed by Naapitol and to seek appointment of independent arbitrator by the court. The management is confident that the entire amount is recoverable. Accordingly as a matter of prudence the company has decided to make a provision at 10 percent per annum beginning from 31.03.2023 and accordingly the aggregate provision as on June 30, 2023 stands at 22.5 percent.
 5. The figures for the quarter ended March 31, 2023, are the balancing figures between audited figures in respect of the full financial year and the published year-to-date figures up to the third quarter of the respective financial year.
 6. EPS is not annualized for the quarter ended June 30, 2023, June 30, 2022 and March 31, 2023.
 7. Due to shifts in market conditions or unexpected fluctuations, there has been a decrease in demand for the product 'Cold Rolled' for these assets, with an anticipated sale within the upcoming six months, taking into consideration the anticipated market upturn. Consequently, depreciation is not provided to assets that fall under the 'Held for Sale' classification.
 8. Other income includes:

For and on behalf of Board of Directors of UNISON METALS LTD
 (DIN: 00297447)
 Managing Director